





The original book has got page numbering errors.

realpatidar.com

૫ દોવા સબાને કુરઆનાની છે

૬ દોવા દેવથાપના સકાને

૭ દોવા સબાને નોબાનાની

૮ દોવા સબાને આરતીનાની વા

૯ દોવા આરતી ઉપર પરગટ

૯ દોવા પાટ સાકુવાના

૧૦ દોવા પાટ સાકુ ફેરવાના

૧૧ દોવા પાટ ઉપર આબા સુકવા

૧૨ દોવા આરતી ઉપર ઇર સુકવા

૧૨ દોવા પઈસા સુકો ભરવા ના

૧૩ દોવા જમસને ઉપાડવાના

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

18 [illegible]

19 [illegible]

20 [illegible]

22 [illegible]

23 [illegible]

24 [illegible]

25 [illegible]

26 [illegible]

26 [illegible]

27 [illegible]

28 [illegible]

29 [illegible]

31 [illegible]

૩૪ ધોળા બાકજરમાનેપાદાના

૩૭ ધોળા ભાજ્યાહિસરનેપાસના

૪૦ ધોળા સિકતાનેધાનો છ

૪૭ ધોળા શ્રીલદેવ રખેશ્વરનેધાલાના

૪૮ ધોળા જવને જાળાજદાના

૫૪ ધોળા જીવનેધણીના તારવાના

૫૭ ધોળા જીવનેધણીના તારવાના

૬૨ ધોળા જીવનેધણીના તારવાના

૬૪ ધોળા જીવનેધણીના તારવાના

૬૭ ધોળા જીવનેધણીના તારવાના

૭૩ ધોળા પંલાસવંતખાનાના

77 [illegible]

78 [illegible]

82 [illegible]

85 [illegible]

86 [illegible]

93 [illegible]

97 [illegible]

99 [illegible]

101 [illegible]

104 [illegible]

105 [illegible]

૨૦૮ ઘાવા જાજાકૈતીનવાદુરઆકાકેણના

૨૧૩ ઘાવા વરકૈ નાનિ કાકુ ણાજાદુવાના

૨૧૫ ઘાવા કજસદ્ધિ પરથી આબાદિનારના

૨૧૬ ઘાવા શ્રી ટાઈરનાશીરદના

૨૨૭ ઘાવા શ્રી શરાનાપીરુનકના

realpatidar.com

પીરશા આતારે આમાં રાખા ફિંગનાલ
ઉન માહારાજે આપેદરજાયો છે, મ
મહીલાને લોહી મહિના માં રોગ વારતા
રાંકુ ભરાઈ છે પીરશા તમેં ફાગણ નાવ લ
ન કરે પણ ફરી છોડે તર તપ બરસાં પીર
તમોને ભલે આપણું હોય તો જેઠ
મહિને ભરદબો ફરવો પીરશા ભાઈરાજ
તાપ રમત તો માગવા આવે
દેઆરોને ફુણ બો રાહીબ હોય તો
ફુણ ભળો કુળ ધોળ ધ ભાવ દેબો
પીરશા ને વાર કિંબળ છે ત વિરસા પીરશા
પરદેશ માં બાપુઈ નાં પાણી જાર
છે તે માં મદદ આપવાસ્તે ન હે
વ હું તો ગામાં મનજી રફરને પીરશા
માંગાવાટે છે પીરશા માર્સ પાંચવા
ઉમલા આવઉ છે તે માં ૪ ૧૩
મહાસણ, મરતબ ને
૧૩૧૭ મહારાજ ગારા બ ચાંદ
મારશ પે માં પ હુજ આવઉ છે

[illegible]

पारसानान· मास महेला· फर
र फ मानन नरर फामः· हाया मम
हाफिर नाना लखना छे:॥ सत
गोर पायाय मर मां: ओ हर ईमा
म सांहां: आदू वी स न य न न र ण
न: न र अलाय म फ म द सांहां:
नवीनूर सतगोर तं मारो हाया:
पर थं म आठ ला य पु रे हां मं घे:
गोर ईमा मि मं द जी पूा घो: त
रे फाल माल न सत ना पूजा:
तें लई ईमा मा पू हा ती: ॥ १॥
न सत ना पूजा ते गोर ईमा
मने हां थ: हा न ज नी पूजा

पारसंतां अणरांईलनेपां
स:॥२॥ नेंघरंपनेपारगेसा
लसि:तेसका अंपरापरपा
लसे:॥३॥ ताकापपसेतेस
तगारसांकांनाइंदार: तारे
सद्वंपनसांकांईपाप
नेपार:॥४॥ नेसरगपरत
नेपातास: तेसतगारसां
कप्रसूरांनंनकार:॥५॥ आ
नतेनोनेहनणाफिपांई:सा
साजुपनपूने सांई:॥६॥
पाणापांईनणांकांहंनी आ
लेपू: आणगारनारणगपा
रेकां अलेप:॥७॥ तेनासंत
नापांईपातनणाका:सरव

२

[illegible]
॥८॥ [illegible]
[illegible]
[illegible] ॥९॥ [illegible]
[illegible]
[illegible]
॥१०॥ [illegible]
[illegible]
[illegible] ॥११॥ [illegible]
[illegible]
[illegible] ॥१२॥
[illegible]
[illegible]
[illegible] ॥१३॥ [illegible]
[illegible]

[illegible] ॥१४॥ [illegible]
[illegible]
[illegible]
॥१५॥ [illegible]
[illegible]
[illegible] ॥१६॥
[illegible]
[illegible]
[illegible] ॥१७॥ [illegible]
[illegible]
[illegible] ॥१८॥ [illegible]
[illegible]
[illegible]
[illegible] ॥१९॥ [illegible]
[illegible]

नाहरनीपातपरमाणि ॥२०॥
ममीतणीपीरपेगामरपु
नाणरईडमेः णरमा।मरमाणा
कासपेमेः ॥२१॥ ममीतणी
सामीपुरीयाणेः तांपुंमा
ईसकापुरीणांणेः ॥२२॥ त
ममीनीसेवा[illegible]मरणाजेः
सतसमुरासंतापुमाजेः
॥२३॥ णे[illegible]पुमणे[illegible]पुसंतेः
सतपंथद्यां[illegible]ःतेममीतो
पईमांरमाणा[illegible] ॥२४॥
णेहसांहसांपुरीतमरांपु
मणकसेःतणपता[illegible]मरां
परणासेः ॥२५॥ तमेरमेस
रसाकमसरांमांसंतः

[illegible]
॥२५॥ [illegible]
[illegible]
[illegible] ॥२७॥ [illegible]
[illegible]
[illegible] ॥२८
[illegible]
[illegible]
[illegible] ॥२९॥ [illegible]
[illegible]
[illegible]
[illegible] ॥३०॥ [illegible]
[illegible]
[illegible]
[illegible] ॥३१॥ [illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

जम्रआपं इमलेई अरपं
णापूरेः ॥२३॥ आसने नेणीने
धूपणायंजरः आलेनारणं
नर्छे परपूरः ॥२४॥ यणाइव
णीपूणापूरेः नरलेईपपा
सपांधरेः ॥२५॥ नरपा किस
पतीनापासः नरेणारां अ
णाधआंपरपासः ॥२६॥ पां
मततपतांनरपारे किः सा
वीस पांचपपणजगपाछे किः
॥२७॥ अपपांनाथईनेपाप
णीनेणिःगारनारआलेअ
पपरागाणिः ॥२८॥ आलेगा
रनारपिढासणिः द्रावाअ
धीजपाद्राढातणिः ॥२९॥

[illegible]
[illegible] ॥३०॥
[illegible]
[illegible]
[illegible] ॥३१॥ [illegible]
[illegible]
[illegible] ॥३२॥
[illegible]
[illegible]
॥३३॥ [illegible]
[illegible]
[illegible] ॥३४॥ [illegible]
[illegible]
[illegible] ॥३५॥ [illegible]
[illegible]

जांहांहितारिपांप: ॥३६॥ पुरीआ
सासछोडांपिपुरंष: गोरना
तनीपुरीआआसासारिपाहिद
रष: ॥३७॥ ओलिसाकुनेनसं
नपापि: तिआरपरिडीनीसे
गंतिनईजपि: ॥३८॥ जप्पीतेने
ओरलीपुरीआपापि: नतन
तहालजुणारीनिषांहांनजापि:
॥३९॥ जप्पीतेनेपुरीआंआआ
रसुनरजेरेहि: ओपीहीपातेगो
रईजाजसांहांपिहि: ॥४०॥ सत
गोरईजाजसांहां: नरअलाष
हंषदसांहां: ॥४१॥ हपुलाओ
लाहा: ईललाहा: षहषंदरसु
ललाहि: हीपा: ॥ २ ॥ ॥ ॥

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible] ॥ १ ॥
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

कपेदसांकां:-नरनी व्रसतगोर
तेमारीदीवां:-पसंपना-मोघारः
संसारनासरजेनकारः-वोलूदा
पेंघरो-अय तारः-रेकनापाजे
पेरः-दायसपाजेपेरः-नेकेपा
नवरघरोः-प्रेदानेपोसपूलें-आ
सेनेपरोः-सतगोरईपापसा
कां:-नरआलोपकपेदसांकां:-कप
ला-मेलाका-ईललाकं-पकपे
दररसूललाकेः-दोवा॥११॥
दोवादवाजेतनेपरकापनाछे:
परपानजो-पासपाला-कररेक
पांन-नररको पंः-सतगोरपाआ
परंपां:-मेंदरईपापसांकां:
आदमीसनवनरजेनाः-नरर

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

આતાંજેઈ બનાં: નજી આપાસ:
પવનપાણી: ગાંપતી પરગટી:
જુગજાગાંચ જા: આદિ બેઠા આ
વિચારી: જરનીબાસંનાં જરે: તે
નજની આસાપૂરી: આદિમ
રંજાઘરથાં જાં: આદિસનાપ
પરગટી: આંનતરૂપિમલચંપા
ઘો: જુરતારજુરતસાંઈ: સતગો
રઈજાંજસાંઈ: નરઅલીજ
જદસાંઈ:॥ ઈજુલાઅલીઈ:
ઈલલાઈ: જઈજદરરસલલાઈ:
દોવા: ॥ ૫૨ ॥ ॥ દોવાજ
જાસહિ ઠાડવાંની છે: પરજાંન
બીસજલાં: ઈરરેઈજાન: નરરઈ
જ: સતગોરઈજાજસાંઈ: નરઅ
લીજઈજદસાંઈ: નબીજરસતગો

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
॥ ५३ ॥ [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible] ॥ ५४ ॥ [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

॥ २२ ॥

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

पांडुरसनमाहाभीगाम आठ
खेडा नामो डीलअवा हीहीछे
गरथ सतवेकाा आंद्या अवत
र नवलखप्रीहस मो अवतार
ठ मावारी रीरूपीनी हीहीछे
पमनशाणु ॥ आवो तो तीमानथा ॥
माणुनाम रूपी ॥ मानारोनोनराजा
र ॥ मानरणपतपुरणमा ॥ जुगम
नो आपशा जिन उतरीआ नमा ॥ ❀ ॥

रगाथास तंथारोपवरी:सतगो
रईपापसांहां:नरञ्ज लोपतह
पंइसांहां:ाहप लोञ्प्रेलोहांई
लोलोहां-पहपंइररस्वलोहां:
हीवा:॥ १३ ॥ ❀ ॥हीवाथुनास
पाहीसरहोनाछे:॥ फरपानञ्.
ल्ासपलो-हररहेपांन-नररंहा
पं:सतगुरपाञ्लरंपां:ञ्नेइ
रईपांपंसांहां:ञ्ाइल्ासनव
नरवंन:नरञ्जलोपहपंइसां
हां: तंथारीहीवा: ल्ासनपछ
पवंत-पाहांथेथारगा:सपतछ
पवंत:ञ्ंनातयतपंगा:स्वांगा
तंथानुसीगासेहा:तेथेथापे:
तंपेनरपरपरी:धरपाते

जारांपासघरीःतंपेःअंनतवा
रथापीःतंपेःअंनतपारअोम
रीःतंपेःअधरपेहनेपांःअोप
पसपीःतंपेःआहनारांःअोपप
पापरपासोःनाहपपेहापा
घाःतेहपजगाजगाःआवीए
पतरांःघरपरपांःघरपा
सनपःघरहेपपाकसरःअ
धरपेहनीपपाघरीःघरपां
अलाईसपरःतंपेपूरतातंपे
करताःआहपेरपांःअंघरपा
पीःअोःसोहसनापापरोईः
अंनतरूपेमलचपाघोःपर
तारपूरतसाईःसतगोरईपां
पसांकांःनारअसीपकपेहसांका

॥२५॥

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

रां:अमना:धरयांवसपूरां:
अवल:आमरनातारेनां
पिछी:अधरयंदनापूधाद
रां:तंपिधरनारहरूपपूरां:नां
तृहापनासूलतांन:आद
अंतेतंपिछी:सतगोरईमां
नसांहां:नरअलानहमेद
सांहां:हपलाअलाहाई
लहाहीनहमेदरसूलला
ह:दोवा:॥१५॥ ॥दोवा
पूधासे:आमातारीनेसरदी
फरवानीछी:॥फरमांनाअ
सपला:हररेहमांन:नरहा
न:सतगोरपात्रअवरेमा:
अंदरईमांनसांहां:आदप

॥૨૭॥

સનપનારાં... નઃનરઃ પ્રત
પાહપંદરસાંહાંઃ તેવારીદાવાઃ
સ્યાંજીપાનપુલના જુગાતારી
તેપીછીઃ ઘરપારનાઘાની તેપીછીઃ
ઘરપાપાસતેપારીછીઃ સ્યાંજી
દાતાજુગાતાતેપીછીઃ અરપા
પાહસરઃ આદનારાંઃ ત્રીજાઃ ઘ
રપાપાસપુરીઃ અપલ આપ
રનાઘાંહાતેપીછીઃ અપરપંદના
પુપાઘરીઃ તેપીપરગારરપપુ
રીઃ નાંમ્ભુદાપનાસલતાંનઃ
સતગારઈપાપસાંહાઃ નરરે
લીપાહપંદસાંહાંઃ હપુલાઃ ત્રી
લાહાંઃ ઈલલાહાઃ પાહપદરરપુ
લલાહઃ દાવાઃ॥૨૬॥

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

realpatidar.com

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

घसपहनाजुगतारीतंपेछी ::
स्वांमीमुखआमोहनसहपहना
लोभ्यानानाजुगतारीतंपेछी :
स्वांमीअंवअलभालनाजु
गतारीतंपेछी :: स्वांमीपरपाल
पासंनानाजुगतारीतंपेछी ::
स्वांमीहातानाजुगतातंपेछी :
स्वांमीपांनफुलनोआरत
पारीछी :: स्वांमीतंपारोएरपा
र :: स्वांमीपानफुलनोतंपोल
आपोआर :: सतगोरइमाम
साह :: नरअलीमहमंदसाह ::
हफुलाअलाहाइललाहो
महमंदरसुललाहि :: इापा ::
॥ १८ ॥ ॥ इापागोरनो

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

साहां:॥१९॥सैदपहवंदसाहां:
॥२०॥सैदअलिपदसांहां:॥२१॥सै
दनासरसाहां:॥२२॥सैदअस।
अलिफ:॥२३॥सैदपाहलअ:॥२४॥
सैदपसतां।ः॥२५॥सैदपई
ऐदीन:॥२६॥सैदअमनसाहां:
॥२७॥सैदव्यालफसाहां:॥२८॥
सैदनीजारसांहां:॥२९॥सैदस
सपालसाहां॥३०॥सैदसला
अलादीन:॥३१॥सैदसंसदीन:
३२ सैदनसीरदीन:॥३३॥सै
दसाहिबदीन:॥३४॥सैदसाह
रदीन:॥३५॥सैदअलीरदीन:
॥३६॥सैदसतगोरपाथअपरणां:
अहेरईपापसाहां:॥३७॥

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

करेपंसा:॥२४॥करीतमत:॥२५॥
आपुरासपंनी:॥२६॥आपुरपा:
॥२७॥रापप:॥२८॥हेपपु:॥२९॥आप
रीत:॥३०॥हाकपरूप:॥३१॥कारा
र:॥३२॥पंसा:॥३३॥आपनरीपु:
॥३४॥आपापुरासपंपा:॥३५॥पन
पसाकार:॥३६॥पारपुड:॥३७॥
गरूआंकेग:॥३८॥पंनातेनं:॥३९॥
आसांनीपूरी:॥४०॥आपपरतेनं:
॥४१॥पाआंपंसा:॥४२॥करपंसा:
॥४३॥पपरपपंसा:॥४४॥ईपपं
नंद:॥४५॥संनानंद:॥४६॥परीपु
गत:॥४७॥पंना:॥४८॥पद्दप:
॥४९॥नंपदगना:॥५०॥नंदप:
॥५१॥कारूदप:॥पर॥पनंसरप:

[illegible]

[illegible]

घरनेपाटः तांसांहिलीपाटे
अंपंरांचरणीयाटः॥१४॥सत
गोरईपापसांहांः नरअली
पहपंइसांहांः हपलीअलीला
हा·ईलीलीहिः पहपंइररस
लीलाहिः दोवाः॥२२॥ ॥
दोवाफ़पासने·अाचइसा
हिइपहिलया·नी छेः फरपान
ण·पीसपलीहररहिपा·नर
रहीपः सतगोरईपापसांहांः
नरअलीपहपंइसांहांः नपा
हरसतगोर·तेपारीदोवाः अा
आ·इंपंहा·पुरलापइेपः सा
रपांहांः सारवांहांः पांसतेन
पापुः सातपलीअपुः सार

[illegible]

[illegible]

तारांद्रूपती: पंनपुासपुती:
तीलनीदीपी: रखवांहाा: स
पुतमतेवां: नीजाना: आ: अ
लमनारीजंना: संसारनापा
आ: अेपुलामनि: अेसीहनी
र: पीरपेजाामर: सारपुरीजा
पुपापरपार: छंपंनपुरीडप
पापरपार: सीचसीचहासे
नी: परपार: नपांहपुरीडनी
मा: छंपंनपुरीडपेघां: मचा
सपुरीडपुनर: तेचासपुरीडा
दीपता: अंनतपुरीजनापार
हसंनंसाहा: नरअलीपाह
पंदसांहा: सतजारईपांपंसा
हा: नरअलीपाह पंदसांहा:

कपलाेऋषीलाकां-ईललाकां-ज

कवेदरस्मललाकि: हाथा।।

।।२५।। ।।हाथापदस

तेपंछीवेदसांकदपवेलव।

तीछि:।। पर्वाजमंजा: आसव

सा. करवेकिवातातरचवाक:

सतगोरईवानसांकां: नर

ऋलीपककवेदसांकां: नब्बा

नरसतगोर. तवातरहाथा:

मेहासुरने: नवलाखतारा:

सातफारसंता: नरवेकवे

दसांकां: नरजगारां: नरने

नतरांधांर: ऋपरसा. धार

सा. नेलाकांपूंलवा: तवंई

धारहाथार: पेकिसतगोरभ

रषां॥सतपंथसहदाऽओतंषजा॥
षगातषाहिरेहा॥ऐइ॥तेअरषं
हीपाराः॥सतगोरईषाषसा
हां॥नरऽअलोषहपंहसांहां॥
हथलाऽअलाहां॥ईललाहां॥
पंहपंहररसलसाहि॥हीपा
॥२५॥ ॥हीपाहसहै
साछारनाभासरहीपर
पानीछि॥फारपांनजा॥भा
सपसाहररेहिपान॥नररहि
प॥सतगोरपाऽअरपा॥अ
हरईषाषसांहां॥आहपास
नवनरजंना॥नरऽअलोपह
पंहसांहां॥तंपारहीपा॥अ
हपारः॥षहपारः॥जंहपारः॥

नरवंननरांपुरः आदमत
ररांपिआथिंनः तंपिपाटापा
रणीः [illegible] पररपुजः पुजपाळीद्दा
पुरतआरः पांहिणवरवंननरां
पारः आरपाररसः तेःअपि
जनारः पांहिसातसरहानी
आयारः परदपांडांजपी
दहानः पुजआ तीपिरसंपां
नः पुजापररपांनतेनापीहे
छीरः घरतीअसपांनः रहां
अपिपरांः सतरदेसांनेपुजा।
आरः पांजालजीजालसहव
सतारः सतसं तांपीहीहआ
पारः ईहधपीरपी संसारः
पुंननरपुलसनाजेदः जजा

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

पाहुपंनाः नेतंपुतेसंपाम्याः

सतगोरइपाणसांहांःनारम्मला

पाहपंद्सांहांःहपुसाम्पेसाहा·

इललाहांःपंहपंद्ररररसुललाह

हेः दोवाः॥२१॥ ॥

दोवापोलरमेसारनेहिनंदा

पाद्वानीछे॥ पारपांनण·प

सपला·हररेहिपांन·नररहाप॥

सतगोरपाग्रपारपाःम्पोद्र

इपांणसांहाःम्पाइपीसनप

नरणंनःनरम्मलापहपंद्सां

हांःसतगोरपीर·प्रपारद्दानाः

सतगोरपीर·सोइरदानांःसत

गोरपीरसाहिपादानःसतगो

रपीर·नासीरदानःसतगोरपीर·

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

2010 Before -Satpanth Manuscript 11 -Pooja Vidhi & Others (161)

बलोमतारांनेहिंवंदाः मारपेथ
नेहिंवंदाः नवपदमनाग नेहिंवं
दाः सातसंमुद्रनेहिंवंदाः नव
सेनवांकुनाद्दीनेहिंवंदाः सात
पारसतावासनक्षेत्र नेहिंवंदाः
पनारतधमारमुरमा नेहिंवंदाः
नवग्रहनेहिंवंदाः सातद्वीप नेहिं
वंदाः नवखंडपरथीमा नेहिंवंदाः
चौवीस पत्ला त्रिभुवन नेहिंवंदाः ए
अठारभार वनस्पति नेहिंवंदाः अ
डारनारघंनासपता नेहिंवंदाः
आरमाकृती आरघांकृती नेहिंवंदाः
आरवेद आरपर्वत नेहिंवंदाः
अनेकं नीतेल अनंनादनेहिंवंदाः
आदअंतपेदनेहिंवंदाः अमर

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

पुरशोपुरसफलनाहिवलोपुरनेकि
जेहाः॰आंनतपुरशोडाहिवनेकिने
हाः॰नाबीनरसतगोरः॰नारआ
सलांभसांहांः॰कंभारांघांनाभ
पुरसाः॰सतपंथनांभारगांभां
राखोः॰लखमओरासीनाफेरा
टाळोः॰तेत्रीसपुरशोडीनाफेआ
आपोः॰नांभुहापनाघंमांः॰
सतगोरईभांभसांहांः॰नर
आलीभकभंदसांहांःनाकपुरला
ऋलाकाःईलसांहांःभकभंदर
रसुललाकिः॰ ॥होवाः॥ २८ ॥

होवापेलीपासनववंतेथा

2010 Before -Satpanth Manuscript 11 -Pooja Vidhi & Others (161)

नोंपाडऐा ... ॥ लाभसी:

फरमांनजी-अलसपलाहर
रेहमांना॥नररहापा॥सतगो
रपीरअरपा॥=प्रेहरईपाप्र
सांहा॥=प्राहलासनावनरणे
नां:॥१॥नर=प्रलीपहमंदसां
हां॥सतगोरपीरपूअरदानं:
सतगोरपीर॥सदहरदाना॥सत
गोरपीर॥साहेबदाना:॥२॥
सतगोरपीर॥नासीरदाना॥स
तगोरपीर॥संपसदाना॥नार

अससलां पसांहां॥ नरअलो
नरजंननाथ॥३॥ नाप्यानदर
सतगोरतंभारी हो बा॥ स्वामी
तंपिआहिरे भा॥ पछि असलिभा॥
मतुरगुराते पिअपधा॥ अंहुपां
रनरजंननाराप्यांर॥४॥ रूप
नापंहतेसांहां आप्यांरा॥ नरजं
नताहि हिपतपुरी॥ सतसीने
रूपनांहरी॥ हरी अंतां घरा अम
पतारा॥ भा॥ मतुरपि दप्याधाप्स
तारा॥ तंपिनरजंननाराप्यारा॥ म
तुरजंजाभाद सि अपतारा॥ सां
हाभछी॥ ६॥ सांहांप्यांरेजा॥ सांहा
पारा॥ सांहां श्रीनरसांहां अ
पतारा॥ सांभापुरा ऊपजापर

पारः।।७।।सांहांपापंना।।सांहां
प्रस्सरांप।।सांहांश्रीरांपाट
पतार।।छ्वीसपूरोडपूपप
रपार।।८।।सांहांपूरसंना।।
सांहांश्रीप्रुद्ध अपतार।।छ
पंनपूरोडपूपपरपार।।सां
हांजूरतवा आंरती।।९।।सां
हांश्रीनपूषीप्राहसंपा अव
तार।।सेत्रसेत्र हांसेनापूप
परपार।।नावनारसतजो
र।।नेर असलांपसांहां।।
।।१०।। सतजोर सला ओहांना।।
सतजोर सप सहीना।।सतजो
रनसारहीना।।सतजोरसाहि
बहीनः।।११।।सतजोरसोहर

दीना॥ सतगोर पधारहाना॥
सतगोर ईजांप सांहां॥ नार
अंली पाक पंड सांहां॥ ॥१२॥
नरनंनन पवे पानारां अवेस॥
तंपारी नाई अते। तंपारी हस
तरे॥ पु पांन रवी सरपंहा॥
नरनारी पापजो पापनी
पापमनी सापुपुलपुरा॥
॥१३॥ नी सांनी जेहे पानीना
रोजपुपु लपुरी॥ पांमतन
पांपु॥ रुआं पापु॥ अरुआ
पापु॥ ॥१४॥ नपतंनसांपु॥ हे
पआसीस तंपारी॥ पंहजा
अंपारी॥ तंजेपुपु लपुरा॥ ॥१५॥
तंपारे जापसजावे॥ तंपा

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

॥३६॥

नीसीपुरुषलपुरी॥नीसांनी
नारीनपुरुषलपुरी॥तंपा
राजअरपार॥परपारसाथे
पुरुषलपुरी॥तंपारुपापु
नीसांनीपुरुषलपुरी॥तंपा
रेपुरंपी.तंपारेघरंपी॥पुरुष
लपुरी॥भंडारीनीजा परसाजा
पीपुरुषलपुरी॥तंपारीजअ
संनाजीपासंनाजी॥पुरुष
लपुरी॥दीसतीतंपारीजी
पुरुषलपुरी॥सतगोरईमा
मसांकां॥नरजअलीमकपं
दसांकां॥कपुलाजीलीकां
ईललाकी॥मकपंदररसुल
लाकी॥दीपा॥३०॥ ॥

दोवा॥२॥

दोवा-तीजो भाहि सरने भाव
नंभाडवानीछ॥ भार रोरसा॥
॥ भर भानजो भी सभवा-
हररहि भान-नरर हा भा॥ स
तगोर भं रं भा॥ जे दरई भा
भसां हां॥ आदपीस नपह
रनंना॥ नारआ ली भ हपे द
साहां॥ सतगोर पीर॥ पुभा
रहीना॥ सतगोर पीर॥ सह
रहीना॥ सतगोर पीर॥ साहि
भहीना॥ सतगोर पीर॥ नासी
रहीना॥ सतगोर पीर॥ सभ
सहीना॥ नारआ सलां भसां
हां॥ नरआ लीन रनंनना॥

[illegible]

નંનાઆંપરદેવ॥પાસતગ
પાગુરૂપંના પાકાંદેવ॥કઈઆ
વીસનાવ॥નાનેવારપા॥નં
ગણિઆસતગુરઈછાપરા॥
આંગધણીઆરદંગનાઆ
વતરાગુરંપંજીસપતનેપા
આપરપરા॥પાઆપાપાઆપે
ઘરોસંતોપ॥તારેનીપંના
અગુરદેલોપ॥આદેસરનાર
ગફાટાપા॥નાફાવાંઆનેન
ફીબીલા॥વરપાંનેઆલ્ખ
રપાંના॥નંઈવરપાઆપ્રપા
ઘૃણાંફા॥દીપપરાંનેએપ્રસા
વૃઈપાંના॥ઈપાંનીનેઆપા
સતપંથ॥છટાલખમોરા

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

॥४०॥

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

त सेने जी र भाइ॥ जी वतें
स रणे संसार॥ भा फिरयर
तें घृ घृ पां र॥ गार नरे ला घा
ज्यंप तार॥ श्री पाछी ज्रि प्ता रषा॥
श्री पा पंन सेणा नंद॥ श्री प
र सं नें पें द र पें ज्यास॥ श्री
न पुरे पा सां हां जु र त णा ज्
ली॥ न भा प ह पं द ण पु ना स
र णं हां हा र॥ र पें स र पं द नें।
पु रो न स ता रो॥ ज्या ठ ला भ प
रं हा ना ज्यं न त पु रो डा इ य॥
म तु र पु ल भ पां हां इ य॥
न पा हां पु रो ड णा भा॥ छ पं
न पु रो ड पे घा॥ भ जी स पु
रो ड पें न र॥ तें जी स पु रो डा

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

तगोर संपसहीना॥सतगो
रनसीरहीना॥सतगोरसा
किषहीना॥सतगोरसहरही
ना॥सतगोरपुखरहीना॥स
तगोरईषाघंसां कां॥नरन
लीधकघंदसां कां॥नरनंनान
पुछिपानारांन्मिकां॥तंषारी
नईन्मतो॥तंषारीदसतरे॥
धुघंनारमिसरमिंदान्मी॥ना
रनारीनीषापगोपालनी॥
भापषन्नीसीपुषुलपरां॥
तंषारेन्मापसनाधिपुषुल
पुरां॥तंपाकुषाकानीसानी
पुषुलपुरां॥नासानीघेकि
षानीनीं॥रांनपुषुलपुरां॥

तंपारिफुरंपितंपारिघरपधु
फुलफुरी॥नारणंनतंपारी
हीसती॥गौरनारनीहीसती॥
तंपाराभरपारहीहीसती॥
पांकाहिप्रआहपआपता
रनीहीसती॥तंपारुमाफु
नीसांनीफुफुलफुरी॥तंपा
रापारांनीहीसती॥गौरन
रनाजापनीहीसती॥मा
फुनीसांनीफुफुलफुरी॥प
मतपेपापारांनुपरतपानी॥
आभरपेहनागिआनहिआ
ननीहीसती॥नासांनीफुफु
लफुरी॥फुफुलफुरांपा॥सां
कांआलीनारणंनानांपा॥नप

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

॥४५॥

पुपुलपुरां पीः॥साऽत्रीस
रा पाग॥ आऽत्री सं पां नार
पहपंदसां हांनीहां सती॥त्रे
वीस पांग सांवी सं पां॥सां
हां पुरतना अली नी हां सती॥
नीसां नी पु पु लपुरां॥पुपु
लपुरां पीं॥ सतुरपीहा॥सतु
रपुतेप॥सतुरपां सां॥स
तर आसां॥सपुतीपरवार॥
आहसप हअ हुपारनीहां
सती॥नीसां नीपुपुलपुरां॥
पुपुलपुरां पीं॥सां हां तेपा
रांपत्री हापुरपानी हां सती॥
सां हपं तेपारा ईछां॥सां ह
प तेपारा ली पा॥सां हप

तंपिसरणां ।। तंपारासरणा
पानीहीसती ।। नीसांनीफ
फुलफुरी ।। फुफुलफुरांपी ।।
अरंपापीसनपनाहसें
पतारनीहीसती ।। नीसानी
पेहेपानीफुफुलफुरी ।। फुफु
लफुरांपी ।। साहेबतंपेपा
फु ।। संपेआंफु ।। नपतंनसा
फु ।। नरणंनतंपाराहीसती ।।
नीसानुआंहुंफुफुलफुरी ।।
फुफुलफुरांपी ।। अभआंहाहीं
नेघार ।। साहेबघंनाअफ
संहाहांर ।। सतजारईपा
पसांहां ।। नरअलीपहपं
हसांहां ।। हफुलाअलाहा

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

॥४८॥

नहिं हि॥ तेस पासा अधां हो

कुलि हि॥ ना अनुर सतगोर

पाज अरं पा॥ ओ हरई पापे

सां हां तेनी सां अ न रि॥ नार

ओ लाप हपंह सां हां॥ नारनें

ननपु वि पी आ सांका ध रि॥

ह रापंस परपा र॥ सां हांपु

रत नो अ ली॥ तेनारां ओहा

नापुवि पी अंप तार॥ आ हपी

सनपु तं पिपुरा अं हा नीस

पा त॥ अं हा नी पुना प नी

पु अ पुल पुरा॥ अं हा नें नी पि

ध रं पि॥ सं त पं भनापार

पा हि न रा पुरा रा पी॥ ह सो

हस पुरीत पापि पो आपा॥

गत नें मात मात्ने जो रां खां ॥
अंन तप्र रो डानी सो व्रत
आपी ॥ फर मां नफा ता आ
प्रफूल प्ररो ॥ जि हे र सं मा
नहां ना ॥ प सं मरात्रीणें न
प्रफूल प्ररो ॥ पर थें जीप
रह खं ड़ा ॥ नुफरडा आपी ॥
रखिसर खं हा ना मा पमा
मो ॥ मां हां ईंन वि मा मा ड्रिजा
रणी ॥ री नवि आ मत माहे
हार ईणी ॥ खं हा ना आप्रम
तखि र ॥ ईमा न स लो मंत
राखी ॥ मां स-सा त ॥ न प ॥ भा
रा ॥ तशी स प्र रा डी नो हि जो
भ्मा लो ॥ लखं मोरासी नो

ને રોટલી॥ ધંન ખાપૂવર
ની સો ભત પાસં ખો॥ દે હિદ
રહંની આ॥ સે સ ન આ ભર॥
સતગોરઈ પાપ સાં હાં॥ નર
અલી પહ પંદ સા હાં॥ હપલ
ખેલા હા॥ ઈલ લા હિ પહપં
દરરસુ લ લા હિ॥ દોહા॥૩૩॥
❀ દોહા॥૫॥ ❀ દોહા જયં
પાઝા લી ઘાની ઘં નાસ્તિ રાંયા
ની છે:: ગાબ પાસ્તિ ગોરઈ ને તા
ભા પડે॥ ભર પાન જે॥ ભલી સપ
લા॥ હરરે હિ પાનનરર હીપન
સતગોર પાગ ભર પા॥ અદ
રઈ પાપ સાં હાં॥ આદવી સ
નવનરમંના॥ નાર અલી પહપં

ईसांहा॥ सत गोर पीर पुणी
र दीन॥ सत गोर पीर॥ सुदर
दीन॥ सत गोर पीर॥ साहीण
दीन॥ सत गोर पीर॥ नसीर
दीन॥ सत गोर पीर॥ संपास
दीन॥ नर ऋप सला पेसांहा॥
नर ऋप ली नर ओनना पा॥न
णीनर सत गोर तंपारा॥
दोया॥ दीयां नण्या ईसांहा ने॥
तंपारे पारे ऋआ यां॥ तं पे हीहणा
हि ऋप ले ही हा पाघां॥ तारे ण
रं पावा सनया॥ पा हि सरस
पुत कुपण॥ तां हां पीसे स
रप ही॥ तारे णरं पानी से स
रनाचं शा टीजा नपे ऋआ॥ ते टी

॥५०॥

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

realpatidar.com

॥५२॥

अपरतीतणा पतं पारी छे॥
तेणा पतो पापंन पुरी॥ तं पे
पापंनपुरा पाणो ग छे॥ अ
ण अमपर पेहनो पां अपे॥ अ
सत पंथ नो आ हांरे॥ अण
पनोपापंन पुरी॥ सी पसीस
पहासीनी॥ पोलपु अप
नापरपारणे॥ परतापेपु
रीफंपा हांनांमपुसी॥ णामु
हीपपु आरपु मेपनो॥ अ
सत पे पुरी फंपारु हांनाम
पुसी॥ ताफांणनरणंन मेठा
फा अ॥ तेनेपरतापेपुरीनो॥
फंपारां हांनमपुसी॥ सहेद
लापुपाणेपां हीदेप ताफा अ॥

तेनेपरतापेपुत्रीनो॥ हपारा
घंनायंपुसो॥ साहेब तेणे
साधा॥ तं पारासतपंथसा
धो॥ ओपोहोई तं पारासतपंथ
पा॥ हेव ताहो श्री तेणं हसा
धा॥ ओहो श्रा अपुसअजारा
ह॥ व्यारपुरा डोनेसतपंथ
हेयाडा॥ ते सतगोरसुहेरहा
नसाधा॥ तंपारे सतेतंपा
रेहते पुरीनो॥ श्री जयनाघे
नायपुसो॥ ओपो श्री घंनेजा
रजयतंपारे सोजासं हो श्रा
पे॥ ते जयनाघंनायपुसो
अजो अजो गोरगतनाघंहो
छो॥ धार या हानापंराहुता

रो॥ मोरासो अपतारना
दृष्टनेपारी॥ जो अदृष्टपे आ
सापूरी॥ अंपरापर पाथा
सपुरी॥ जुलाजा पगापती
परगरा॥ ६ मो आ आ आर॥
सरवेजाण तं पारी पुकारो
रामो॥ ते ओसपुरी डानो पेजो
आपो॥ अंनत पुरी डानो सो
अत पारां भो॥ मे हे रसं पान
हांना॥ परथं पापर दृष्ट मो
नुहां नगा॥ पसं परा जोअंन
पुअूलपुरी॥ आसत पं पन
आहारी॥ अंपर पे हनेपा आ
पे॥ जनर नां अदृष्ट [illegible] आ॥
तेने परतापे पुरी ने॥ नपुरो

[illegible]

॥५४॥

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

पूरी भाप पुरी॥ सातपुरी डी
सुकरंसंहनेतपेपुरीभापपु
री॥नपपुरीडी सुणनेसतपा
नेतपेपुरीभापपुरी॥ आणं
पुलनेजनाला रपुरीडीनांगे
रसस हरहीननेतपेपुरीभाअ
पुरी॥ कपेपुलनेजासंघिजार
जेहरईभाभसांकानेतपेपुरी॥
जेजमपनापराछतरापी॥पु
भपापुपरनी साअतमारापी॥
सातपरसंतासेगसेसग
कासेनीपुसेपुजेपनीपर
पार॥ आजनेजारईमांमसांका
नीहासतजेपुरी॥ जेनीपग
तमाहामसपजेछि॥ तेपुपस

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

સતગોરસુરદેવહાનનીહોસ
તી॥સતગોરપુણીરહાનના
હોસતી॥સતગોરઈમામસાં
હાંનીહોસતી॥નારાયણલીમહ
માહસાંનીહોસતી॥બ્રહ્મણય
નાઘંનામામપુરો॥સતગો
રઈમામસાંહાં॥નારાયણલીમ
હમંદસાંહાં॥હપુલાબ્રહ્મલાહાં
ઈલલાહાંમંહમંદરરસુલલા
હઃહાલાઃ॥૩૫॥))((હાલાઃ॥૧
॥હાલાજ્યનોઘંના॥
ગાયાનીઈઃ ફરમાંનજ.બ
સમલાહરરહમાનનરરહ
મ॥સતગોરમારબરમા॥
હરઈમામસાંહાં॥આદમસ

[illegible]

सांहां जहंपंथ॥ सांहां जुसतपा॥
सांहां जुर तणा अलीन॥ सांहांस
मसत इलला॥ सांहां नाजत
पि अलला॥ सांहांनां ज तं प्रेम
प्रीला॥ सांहां सतारा॥ सांहां
गुफांरां॥ सांहां परवरदिगा
र॥ सांहां मालेक॥ सांहां भेसला॥
सांहां श्रीजछ॥ सांहां श्रीप्रार
ज॥ सांहां श्रीपारां॥ सांहां श्री
नरसांही॥ सांहां श्रीयांजना॥
सांहां श्रीरांम॥ सांहां श्रीपूर
संना॥ सांहां श्रीबूध॥ सांहां
श्रीनकलंकी शाहसमा अवता
र॥ सांहां अलल पंईसपेहीं॥
नर अलसलांम सांहां हाहतार॥

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

तं पारी॥ स्यां पीतं पि सं न्नाषी॥
सां हि ष्प पि हिर तं पारी॥ ष्परी
न्नाद कं पारी॥ ष्परी न्नाद न्नाष
ल नी॥ ष्परी न्नाद न्नाष्परनी॥
ष्परी न्नाद पष्पी पुसा ष्परनी॥
ष्परी न्नाद पुल रषीसरगात
गंगा नी॥ ष्परी न्नाद पीरसघी
नीघारजी पुनी॥ सर्वां पीतं पि
न्नाष ल॥ तं पि न्नाष्पर॥ तं पिद्दा
नाहं नी न्नाना ष्पाद सां हि॥ तं पा
राजुहा नीपारन हि॥ न्नं पारा
न्नाष जुड्गा नीछिन हि॥ तं पारा
नाप (हु)पर पि लहारनां (हि)॥
तं पि न्नं पारूरं हि पलाप सो॥
परी न्ना पान न्नु पाप सो॥ प

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

दाधी॥ आणपु लेमुग प्राते
पाप्रातं प्रेपा लां॥ पीन तीन
पीनुरस तगार नी॥ पीनती
स तगारस लो आ दी नं नी॥
पीन ती स तगारसं प स दी
ननी॥ पीन ती स तगार नसी
रदी ननी॥ पीन ती स तगा
रसा कि सदीननी॥ पान तीस
तगार सु हर दीननी॥ पीनती
स तगार पु पीर दीननी॥ पी
नती स तगार ईभां प सांक।
नी॥ पीनं ती नर आ सो पंकपे
इसां कांनी॥ आ इनरनंनतंपे
जप नपु पु लपुरां॥ नगीन
नापा तपु तारां॥ स तगारई

[illegible]

नपा॥ घं टे दे पत्राके सरा॥ स्पा
मीसलाभत्रे (अागसा॥ वा
ससेसन॥ अेतामारजगना
कंसाअलम्पां॥ अवरनाजा
फुफेता॥ मारजगपामोरासा
अपतार॥ स्पांपा हेनातंपेफरा
नसतार॥ जेफोईपानेहेनेस
रगापरा॥ जेफोईनंपानेतेने
नरगायारा॥ भारगारनेकरा
मइनाघा अे॥ तेजपअंप
रापरापरजां अे॥ अडसठती
रथनापमपलोनें ते॥ भरटल
लाअे ते॥ जेपारफुंपजंपापा

लाभ्रा॥नेहि प्रीमनरघरी॥प
सीञ्मानापसराथां॥ञ्रीञाव
नेप्रीघाघंनामपसां॥मनजा
नपरांचसां॥पाम·सांत·नाव·
मारु॥तयी सपरीडानाजिया
ञ्मालां॥लमसांरासीनांफिरी
रालां॥संगलीजंपातसुदेदा
रञ्मासां॥ञ्मपरापरपापास
घरी॥स्यांपाञ्रीपांतपरी॥दे
हात्रघरपरी॥रसांसरनेरान
ञ्मापां॥स ता ठुनासांमतरा
मां॥घरपसाधापां॥परा छत
प्रापां॥सापपसपरीतञ्मा
पां॥रहिमनानजरघरी॥पडा

પરતે પરગાટ પુરી॥ સર્વપ
રછતરઘરી॥ નરનાપીજકં
દસાંહાંનીપુજાઓ॥ તપે પરગ
ટરૂપપુરી॥ સીગાસંહાતંપાડુઃ
તંમાંપાંમાંતંમા દુખાજા॥ પુરગ
ાપ્રાનાઘરી॥ સંમરાસારપુ
રી॥ ઓ પં દાઘં નેઘારઃ સાહિપ
ઘંનાપપુસંહાહાંર॥ સાહિપ
તંમારાદાસતી॥ દીપાનાપાદ
સાંહાંજ॥ પુરંમઘરંમતંમાડુઃ
જાપજગ તીઈમાનાઓંમાડુ॥
તંમારાપંદાનાઘંનાપપુસા॥
તંમે સાહિપ સુલ તાંના॥ પારા
નાસરગાઘર॥ શ્રીમછા તંમે॥

श्री प्रौर ज तंपि॥ श्री था
रां तंपि॥ श्री न र सा हा तंपि॥
श्री थापंन तं पि॥ श्री पस र
स रां प तंपि॥ श्री रां पं तंपि॥
श्री पुर सं न तं पि॥ श्री पू
द तं पि॥ श्री न पु वि पु तं पि॥
अ पी र पुर त णी अ ला॥
न पी नुर स तजीर॥ न र अ
स सां प सां हां दा ता र॥ नर
अ ला प ह प द सां हां पु सां
हा॥ ना पू दा प ना स स तां
ना॥ तं पि णा पू ना ता रं हा हा
र॥ स तजा र ई पा प सां हा॥
न र अं ली प ह पं द सां हां॥
ह पु सा अ ला ह ई ल ला हा

पहपहेररसूल सांहि॥
दोवा॥ ३९ ॥ ॥ दोवा॥ ६॥
दोया जप नेहां ना॥
त रायानी छे॥ पसपा
नजः प्यीस पंसा॥ करके
पानः नररकी पा॥ सतीरप।
यप्पर पा॥ अहेरईपापसां
कां॥ आ हयीसनयनरनं
ना॥ नरअ ला प कपं हसांका॥
सतगार पी रपुन्ना रहीन॥
स तगार पार॥ सहेर दीन॥
स तगार पार॥ सा कप्प दीन॥
स तगार पार॥ न सीर दीन॥
सतगार पीर॥ सं प स दीन॥
नरअसस लांपासा कां॥ नार

[illegible]

श्री पुरसं नरूप नी होवा॥ सां
हां श्री बुधरूप नी होवा॥ सां
हां श्री नपुसीपरूप नी होवा॥
सां हां श्री पुरतणा अंसी नी
होवा॥ अपुसासन अंसी
हणारधार पिंगाअर नी हो
वा॥ धर ती अंसपान नी हो
वा॥ पवनपाणी नी होवा॥
असरपुपपरअत नी होवा॥
नपपुपनाग नी होवा॥ सा
रपुपसिधे नी होवा॥ सारमां
हां सार वासा नी होवा॥ सा
रचिंद सार पुटम नी होवा॥
संहा सुरण नी होवा॥ नाव
लाम तारा नी होवा॥ इरूपे

[illegible]

नाहीं पा।। प खी पु सा पर नाहो
पा।। प्रोल रपि सरग तगंगाना
हीपा।। नंप ली नंपात नी हीपा:
नखीनु र:स तगोर:न रखसला
प सां हांना हीपा।। अ ड स ठ ता
रपनी हीपा।। आह सपु तमोस
ठला खहीपा ति नी हीपां।। खावा
आ हंप-पापा हं पानी हीपा।। स
य सि सय हा सि ना पोलपु आ
प ना पर पार नाहीपा।। न खीना
कि प त ने आ खरी त पि पा पा
कि गा र णा।। री नर्फ आप त पा
हेहार हेणा।। तं पि हान हं नी आ

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

तत्री सधुरी ठानो नीर्वानमा
र्योमा ॥ ना थ्रू दीप ना घं ठोमा ॥ स
तगोर ईंद्र पां पसां ठां ॥ नर न्म
ली पाठ पंदसां ठां ॥ ठथ सारे
साठा ई सासा ठा पा ठ पदरर
रुस सा ठ: दीवा ॥ ३८ ॥
दीवा ॥ १० ॥ ॥ ॥
दीवा जप नें घं ना छोडावा
नी छे ॥ फर पांन ना पास
पसा ठरर रे ठ पानननर र ठपा ॥
स तगोर पा न पर पां ॥ न्म
दरई पां पसां ठां ॥ न्मा दपा
स न पन नर नं ना ॥ न र न्म सा
पठप दसां ठां ॥ स तगोर पा
रपपीर दी ना ॥ स तगोर पा

[illegible]

[illegible]

रतपुर तणा ऋषि लीनं पी॥

घ ल ऋषि ली॥ ऋषा पर ऋषि ली॥

णा कि र ऋषि ली॥ ध्या तं न ऋषि ली॥

ध्या णर पु ला सा ऋषि ली॥ ऋ

ष रजा रहि ना ऋषि ली॥ य सा षो

र ऋ सा रात णा ऋषि ली॥ षों

षि पा रि षा र पु ता री ऋषि ली॥

णा ध्रु दी पे त पत र आ वो रे

ली॥ ण गो ण गी फ रे प तो प

री॥ ह ई त ना पो ऋषा सा नां जी॥

ध र प नी णि पु री॥ पा प नी पे

पु री॥ सा ग पे हा पु री॥ पु ऽ

प रु क री॥ ऋषि पु ल सु पा पु

री॥ तं पा रा ना ज षो स प हो

णो ऋषि॥ सां हां हा पो ऋषि ना त

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

नी॥ दासती भा भा भाते
भांनी॥ दासती सांहांभर
तनारनमला नी॥ दासती ईभा
भहसन हांसंन नी॥ दासती
भूरांभू नर भांनी॥ दासती
न भीनूरस तजोरानर नस
लांभ सांहांनी॥ दासतीस
लानोदान नी॥ दासती भ
रसंभसदान नी॥ दासती
भीरनसीर दीन नी॥ दास
ती भार सा हि भ दीन नी॥ दा
सती भीरसहर दीन नी॥
दासती भीर भ भीरदीन नी॥
दासती स तजोर ईभाभ
सां हां नी॥ दासती नरनसी

॥१०॥

पाकपादसां कांनी ॥ हो सती
सत्र सं सत्र कासंनी ॥ पू
लख्या-अंबानाप रपारनी ॥
हो सती-अंपूलाभने-अंसा
कनां र-पार पंजा ॥ भरनी ॥
हो सती सात भार संतानी ॥
हो सती नाप नाप-अंतारा
सी सधनी ॥ हो सती-अठा
सी संसा-च रुपा पि नी ॥ हो
सती सात सा करनी ॥ हो स
ती नाप सं नयां कफुन हो पि
नी ॥ हो सती अंदर पारसुर
जनी ॥ हो सती नाप लाभ
तारांनी ॥ हो सती-अमर
पुरापर पत नी ॥ हो सती

नयपुरुषनाजानी॥हीसती
आठपुरुषपिंघना॥हीसतीअ
डारनारयंनसपतीनी॥
अणपनांघांनापापपुरुषा॥
णजीणजानापुरषपधंन
छोडा॥मोराराजाअपतार
नादअणीनाजो॥हीसतीन
पापुपुरुषाडासुणाअनी॥
हीसतीछपंनपुरुषाडासुपि
घानी॥हीसतीअजीसपुरु
डासपेनरनी॥हीसतीपां
सपुरुषाडासुपरसाणनी॥
हीसतीसातपुरुषाडासुहर
संदनी॥हीसतीनयपुरुषाडा
सुणणीसारपनी॥हीसती

॥ ९२ ॥

आर पूरो डा सू पं प ला पू
प र नी ॥ हो सती अ न ट पू
रो डा सू आ र क सं न सां हां नी ॥
हो स ती नें पी आ आ स नी ॥
हो सती पं पं न पा मी नी ॥ हो
सती प मी पू सा पा र नी ॥ हो
सती पो ल र पि स र गा त गं
गा नी ॥ हो सती नें प ली नें पा
त नी ॥ हो सती पी र सां हां ना
ना प नी ॥ अ ण प ना घं ना
अ पू सां ॥ ल अ जो रा सी ना
फ रा रा लो ॥ हो सती पो ल
रा मि ह र गा ना ॥ हो सती प
र प पी ल नी ॥ हो सती जो स
ठ ला अ ह पा हु ना ॥ हो सती

आगानी तेणे अने देयनी ॥
हांस ता स तासंतापाणप
नी॥ हांस तीआर खाणआ
रयांणनी॥ हांस तीआरपे
ह आर पतेपनी॥ हांसती
सात पार सतापासनपे
पनी॥ हांस तीपनर तपप
रणपारनी॥ हांस तानप
घेनी॥ हांस तीअडसठती
रथनी॥ हांस तीहसहसानी॥
हांस ती तीणापीणाजपनी॥
हांस तापखयारांसीजपी
जानी॥ अजयनापापपर
खेपरा॥ अपंहानेपईपार
पापासआपा॥ अपहानपुस॥

[illegible]

र छ॥ पं न मं त ना घं ना॥ आ
पे हीठां ना घं ना॥ प्रांन सा च
पा ना घं ना॥ पं न छा पुरं पं
ना घं ना॥ तं पे पा हर छा पुरं
प पुरा॥ प पुरं प प र ह रा॥ प्रा
घा घं ना प्प पु सो॥ प्री ना न
पु रा प सो॥ हा पां न प्रा हसां
हां ज॥ सां हा श्री प छ तं पे
सां हा श्री प्रां रं नतं पे॥ सा
हां श्री पा रा तं पे॥ सां हां श्री न
र सा हा तं पे॥ सां हां श्री पां पे
न तं पे॥ सां हां श्री प्र र स रां
प तं पे॥ सां हां श्री रां प तं पे॥
सां हां श्री पुर सां न तं पे॥ सां
हां श्री प्रु घ तं पे॥ सां हां श्री

॥१३॥

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

2010 Before -Satpanth Manuscript 11 -Pooja Vidhi & Others (161)

દતં પી॥ દુનાદતં પી॥ સાદ
તં પી॥ સમદતં પીઃ તેનંતં પી॥
મંમ તં પી॥ ઈડ તં પી॥ પાડતં
પી॥ નર તં પી॥ નરનંનતં પી॥
નરનંનતેનરાપ્રાર॥ પેદા
પાદા પ્રરતઆર॥ સમદથી
સરનો સંસાર॥ આદિસર
જઆરનમાંડ॥ અતુરપર
તેપરતીયાણ॥ તારિમરંપા
મઆપરપાંસ॥ દુજનાખંડ
તેજપનેસાસ॥ ચીઆસં
ફાંમિઠારિફાં॥ પાઈદુનેપઅે
નનાપ્રફા॥ ફરીઅગોરનેપ્ર
દુગનાંના॥ નઈસતગોરપ્રી
દૃણાંમા॥ અપ્રપમંનપાનાંસો

अति॥ अलि ई पानी पधरां दी अति
ई पानी ते आसो सत्त पंथ॥
अलि ई पानी पडी आं पां दा॥ पर
पां झां ते पापां घरे पा॥ अपरा
ते दुसर अठां पुरें पा॥ ते नाम
धाम अजा गा॥ अजा सरू पीसर
गो दा गा॥ लखा आसरा सा फिरां पु
रां॥ पुरें शापुल अपांनी अजय
तरां॥ गो अति पुर दि आसं झीर ठा॥
वरां सई ते अ परा पुर गा आं॥
गोकु ई नं झुल आर धूपें दा॥ ते गो
यपां पां अं परने दा॥ से अवा
रां पुलप गोर ठां॥ ता रे परें पा।
नो ठपुं पगो प आ॥ ते ना पी ध
अगा सारा॥ सपुत रू पीर सों से

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible] ||3|| [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible] ||4|| [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

॥११॥

तं पि जाप नि सं पा रो ॥ अं पूजा
स लाभ फेरां पर लि पूरो ॥
आ सतपंथ ना हीस ती ॥ तं पि
जा पू नि पूर ध रो ॥ तं पि जा पूनेवी
को ॥ तं पा री पारे आ [illegible] ॥ न
पी ठर सत गोर पाच परं पा जी ॥
सत गोर ई पां पा सां कां ॥ नार स
ली पा क पं इ सां कां ॥ क पू ला अ
ला का ई स ला कां पं क पं इ र र
सु स ला कः हां पा ॥ ४० ॥
हां पा ॥ १२ ॥ हां पा जा
जा ई हू नी पा का नां ईः फर पा
नां जी पी स पा ला क र रे कि पा
ना नार र कि पा ॥ स त गोर पा
च प र पा ॥ अं इ रई पा पा सां कां ॥

आदुपा सनाथ नरजंनां॥नर
अलीप हपंदसां हां॥स तगो
रपार-पू प्पारहीना॥स तगो
रपार-सहदरहीं ना॥स तगोरपा
र-सां हप्पहीना॥स तगोरपा
रनसीरहीना॥स तगोरपार-
संप स हीना॥स तगोरपार-
ससा-आेहीना॥नरअसा
पसांहां॥नरअलीनरजंन
नापा॥नपा नुर सतगोरतं
पारी हीवा॥ स्यांपी तं पे आ
दनरजंननरांपुारा॥ अ हद
अपीरसीसंसार॥पे लीसर
जाप्पां हाी मार॥म तुर पू रत
पीप स तार॥ सतुरवेदसंम

रांमारम॥ते पानरन नेघरा
अमतार॥नारनारानो अेपु
पामार॥स्वांपा तं पेस तगो
रनेसो पेआ घरं पा॥रआस
तपंथ ने तारापुर प॥न भो
पुरते घरो अमतार॥स पुत
रुपा रमो सं सार॥पा आरमो
अंनत अपार॥तं पेनरनंन
तेसरनं नहार॥ई हनमा हा
पाहि ज पन अमतरो॥अेपु
पीसलाम तं फेरा फेरो॥नु
नरवेद पुरी सां प॥फेरारा
पो अेपु पीसलाम॥अं पर
जो दसु लागु घांना॥प रांगा
रनरने पुहा फर पां ना॥आ

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

॥ २३ ॥

[illegible]

रपीरनसीरदीना॥सतगो
रपीरसंमसदीना॥सतगो
रपीरसलाऊदीना॥नरअ
सलामसांहां॥नरअलीन
रनोहानामा॥नपावउरसत
गोरसंमाजी दीवाला स्वामी
तंपिआदनारणेनदेव॥पार
मापीसनाथ॥माहिसरसेपा
सघतपासरणो सं सारगत
पिनारणेननराधारा॥स्वामी
पारघोसंसार॥पिदपापुरा
पसतार॥सरणपाहोनर
पोपाआ॥पाहो हिपंनातप
हासंपाआपीसनाथ.पारप.
नेपाहिसरअपांपरतपाहो

[illegible]

[illegible]

realpatidar.com

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

पहपइरर स्रुलला हि: दोवा:

॥४२॥

दोवा॥१४॥ दोवा चोथो

नशीनभा मीना छे: फरपां

मण- भीसपसा- हरहेपा

न-नररहीप॥ सतगोरपान

भरंपा॥ अ इरईपापसां

हा॥ आइपीसनपनरनंना॥

नरअ लीपहपइसांहा॥

सतगोरपीर- पुभीरदीनः॥

सतगोरपीर- सदरदीन॥ स

तगोरपीर- साहिभदीन॥ स

तगोरपीरनसीरदीन॥ सत

गोरपीर- समसदीन॥ सत

गोरपीर सलाअदीनः॥

नर अ‍सलोप सोंहां ॥ मरस
सीमरणं नना प्रः न प्ोथर
सतगुर तपारी हीवाः॥ स्वा
मी अ‍ादनरणं नातं प्रि ॥ अ‍जं
प अ‍गोसर तं प्रि ॥ भां न भा
नेच तं प्रि ॥ पुरंभा पुसप न
तं प्रिः ॥ जुगा जुगाचपा तं प्रिः ॥
आसभा अ‍स तपे तं प्रि ॥ द्वि आं
नपा तं प्रि ॥ घ धृ पारपा तं प्रिः
ईभपा तं प्रिः ॥ पा भपा तं प्रि ॥ नाथ
पांभपा तं प्रि ॥ पारपभपा तं प्रिः ॥
तं प्रि जभा ताता तं पारिनाप ॥ तं
प्रि हिपना तेआ पा आपप ॥ स्वां
मा तं प्रि चभा ईप हि पा आ ॥ पुरा
स पु तनेसरणपा आ ॥ त प्रिस

2010 Before -Satpanth Manuscript 11 -Pooja Vidhi & Others (161)

रणा आरेष्यां ग्रा॥ सरणा पंग
नी सरणा परां ग्रा॥ प छे सरणा
आरण पां ग्रा॥ पां ग्रा भा पुरा
पसतार॥ सरणा पेद नेज
कपुरा॥ सरणा से सर ने सप
प सं सार॥ लष आे रा सा फे
रा फरा॥ कूछ पा पा ने स हु ज
पतरा॥ फेरा पडा सहु जपने
अंत॥ र आ पाजा ते सपकाय
नत॥ तं पे नर णं नजां पं कर
फरपा-पा सन पे से सर पर॥
फर ता फा घी आरेष्यां ग्रा॥ ए
तं भ प घं प सरणा पं रां ग्रा॥
तं भे जप तरा जां ना रां जि ग्रा॥
फर पा पी सन प. रेका पर

॥ 63 ॥

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

तं पारा॥ हां सती तं पारा सत
पथ नी॥ हां सती तं पारा ना
पन्नरनी॥ हां स ती त पारा
नी पपांपं डानी॥ हां स ती तं
पारा पुरं पघर पंनी॥ हां स
ती तं पारा अास अाे ला हनी॥
अेज पनु आ सं डा हि ठाडा॥
रपी प हुक पा किपां मा डा॥ हां
स ती तं पारा अर पार पूरपा
रनी॥ हां सती तं पारा पुल पा
पां डा नी॥ अेज पनी पा आ
पु पतां हि ठाडा॥ रपा प हुक पा
किपां मा डा॥ हां सती सं च स
सत्र डा सै ना नी: पांस पा अे
प ना प र पार ना॥ हां स ता

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

पासना पूरे॥ नें जापन आसना
रांभ॥ ते जापन सूभ सांहेला
पूरा॥ हांभ हांहेसा हूर पूरा॥
अ जापने पूरतलीधूने आ
सहा था ठाडा॥ रपापांहप
ने पोयांप पोआडा॥ सूरन
पांहप तेरपी पुफां पा॥ तांहां
फुलरपो सर॥ स तपंथनो
पूनाठांपा॥ अ जापनेपूप
गोत्रपापोआडा॥ पांप सा
त नव भार॥ ते भी सपूरा
डा ना पेसा हेमाडा॥ लभमो
रां सी ना फेरा रापा॥ सांग
पीजेपात सूहें हार आलो॥
अभरपेहपा अ लीहेसंपा

श्रीकृष्ण ॥८२५॥

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] ॥४४॥

॥ [illegible] ॥१६॥

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

साबपनरनंना॥नरञ्मसी
पहपदसांहां॥सतगोरपा
रपुव्यारदीना॥सतगोरपीर-
सुदरदींना॥सतगोरपीर-सा
हिप्पदीना॥सतगोरपीर।नसी
रदीना॥सतगोरपीर।संपस
दीना॥सतगोरपीर।सलाञ्मो
दीना॥नरञ्मसलांपसांहां॥
नारञ्मसीनारनंननापा॥नाप्पी
तुर सतगोर तपारी हींपा:
स्यांपा तंपेना हिरपारा॥व्या
सपुनाप्पादसांहां॥तंपेसां
हां श्री पछी॥सांहा श्री पीरंनः
सांहा श्री पारा॥सांहां श्री न
रसाहा॥सांहा श्री पांपंना॥

॥२५०॥

सां कां श्री पार स रां पा॥ सां
कां श्री रां पां॥ सां कां श्री धुर सं
ना॥ सां कां श्री प्रह्लाद॥ सां कां श्री
नाधु पि प्रा इस पा आवतार॥
नार आरती प क पं इसा कां॥ श्री
सां कां सुस तांना॥ तं पी जधु
ना तारं कां र॥ जे जप बुद्धि
ठा स कां धुरे॥ तेजपने अलो
पी जुपां पा॥ दी यां न आद सां
कां जी॥ तं पी जपुने रखा पाक
जपी आडा जी॥ जे जपनेते
ची सधुरा डाना पिपा पारा
भी जी॥ तें पां ने लें जप जपे
ते जप ने छीडा पी जी॥ श्री
सरपेर अंना तं पारी छी जी॥

अजप नी सं तां ते पने छे ज प
जेसा ला जप कु ठां सं कुप
रि॥ ते स्यां पा ते पि कु पू सक रि॥
जा॥ पा खा पु सां फर गा र नी
र गा त नी हां या पु पू स पु री
जा॥ हां स ती ह रजा नी पु पू स
पु री नी॥ हां स ती न र अ स स
पा सां फां नी॥ हां स ती ह स पा
अ प त र नी॥ हां स ती पां स
र पि स र गा त गां गा नी॥ हां
स ती पा खी पु सां फ र नी॥
आ न पु स न गा पां न पी आ॥
ते गा र न र नी हां स ती॥ न ती
स ती सं तां पी जप नी पान
ती॥ न जप आ स ना पा स

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

रा डा बेद्या थां ता॥ जे मल
जी सपु रा डा पेनर पां ता॥
कपे तजी सपु राडा दे पा॥ ल
पना बेजा पुरा पुरा॥ जाल
दा पना जर कागाता पुरा॥
आ जजर पेर पेदनेपा जेपे॥
आ सत पंथ नेपर तापेपु
रा॥ मर पा. पीसनप. नीपु
पा जे॥ सीच से सच्च का सेनी॥
पा लपा जे पनां पर पार॥
तं पारे सते॥ तं पारे दतेपरा॥
स पसपु तीना पजनेपर
ता पेपु रीने॥ जे जपनेमा
पंन घाटी पां मा डा॥ र पा पं
दप पां पा सजा ला॥ मार

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

॥ ॐ सा हाँ· ईस सा हाः पहमं

दरर सु स सा हेः दो या॥४१

दया॥१९॥

दो या जय नेआ संहाय स

य नी छे॥ फरमान जोग॰ व्यास

पसाहरेहि पानवटर रहाप॥

सतगोर पाचवर पा॥ ॐ

दरई पापसा हां॥ आदया

सनवनारको ना॥ नर आसा

पहपंद सा हां॥ सतगोर

पीर पुआर दीन॥ सतगोर

पीर सदरदीन॥ सतगोर

पीर साहिबदीनं॥ सतगो

र पीर नसीरदीनं॥ सतगो

र पीर सम्सदीन॥ नानर

ई रसो नो तनो [illegible] तातां [illegible]
आधर तने काय आ छुइराद सो
आ उ आधर तने आल यथाये ई
आतर नो आन तराधसो र
य सो ई ये आ कु आतरलसो
[illegible] दर्य यां धांने [illegible] यो ईर्गा रई आ
रई स तां ये ई सा सा सो ये सो
त उ दे सा आर आारो रनो
गा रल रा नो ये ातई सु
[illegible] आ ईढि सो आननो म स
इ रा ये ल सु

[illegible]
એ પાનજી પાધરો [illegible] ઉનો માતરમ
અકુ તેમાં મા પર [illegible] રામ ઉતરા
નાઉ પર વા [illegible] આ છા પાનાઅ
એ ૭ ગર ના પર ગા તે ત અ / તોન
પર તેમ રચ્યા નીકુરી ના તઅર
આપડાં ગાઉતો મ સકુ પાકુ [illegible]
છે તે લખ સા પાનજી છા કુ [illegible]
ન માન નવા અકુ તેમાં કુગાન
લખ સા માતાન [illegible] પાનજી મ
તી સવત ૨૦૦૩ ના માસ માગર સ
પ૧ ૬૭ ન રવવાર નાં ૬ ડાક ઉરવ

अमसलामसां हांसन रअमली
नरणंनना मन नावी भुरस
तगोर तंमारी हां या॥ स्वांमी
तंमि अम हवी॰ सनामनारां
अमि हामन मुपि मी रू मम मर
मा॰वी सनम॰मा हि सरजु
म॥ स्वांमी तंमि श्री मछ॥ स्वां
मी तंमि श्री कोरंभ॥ स्वांमी
तंमि श्री वाराह॥ स्वांमी तंमि
श्री नरसांहा॥ स्वांमी तंमि
श्री वामंना॥ स्वांमी तंमि श्री
परसरांम॥ स्वांमी तंमि
श्री रांम॥ स्वांमी तंमि श्री कृ
रसंना॥ स्वांमी तंमि श्री बु
ध॥ स्वांमी तंमि श्री नकलंकी

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

आ या ग वं न ॥ पू पू ल पू रो ज ॥
अे ज प नि ल प सा रा सी ना
पि रा ना गा ज ॥ तं पि हा पां न
पा इ सां ना छी ज ॥ अे पां हा
न गा न ग ना घं नि घा र छी ज ॥
सां नि प घं ना प पु सं ना ना
र छी ज ॥ स्पां पा तं पि नि नि पु
न न र घ रो ज ॥ अ घा रि घं र पा
अ न पा पू पु रो ज ॥ तं पि ना
पू हा प ना घं नी ॥ पं ता पू रो
अे ज प तं नी ॥ स त गा र ई पा
प सां नो ॥ न र अ ली प न पं इ सा न
न पु ला अे ला ना ई ल ला नां ॥
प न पं इ र र सु ल ला नि: घं पा:
॥४८॥ ॥ घं पा: ॥ २० ॥

हाथानो साज पनं हु ठासं

हूं ऋमासासनी छे:: फरमान

ज:ऋसिस पलो-हररहि मान:

नरर ही पीरसतगोर पान्नअ

रमामन्ने हररई मानन सां हांमन्मा

दथा:सनपनर ज़ंनमनरए

लोमहंमंदसां हांसस तगोर

पार: पमारदीनससतगोर

पार: सदरदीनससतगोर पार:

साहिबदीनससतगोर पीर:

नसारदीनससतगोरपीर:सं

मसदीनसनरअसलामसां

हांसनरअलीनरज़ंननामा

नमानुरसतगोरतं पारी हा

थाना स्थापीतं मेने जपनं

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

दोस तीसी यसं सगहो सं
नी॥ पुलपुां अपनापरपार
नी॥ अजप नै ह तारो पार॥
तं पेजप नातारे हकोर॥ तं
पेनारा ओ हन॥ तं पेनरकं नः
तं पे अलप॥ तं पे अलाः तं
मे रे हे पां न॥ तं पे आदपीस
नप नारां ओ हप॥ नापुपे पुा॥
नपी नुरस तगोर॥ नर अ
सलांप सां हां दातार॥ सला
ओ दान नी आसी सा॥ सत
गोर सं म स दान नी आसी
सा॥ सत गोर न सीर दीन
नी आसी सा॥ सत गोर सा
हेब दान नी आसी सा॥ सत

गोर स्रुदरदीननी आसीस ॥
सत गोर पीर सदरदीननी आ
सीस ॥ सत गोर ईमामसां
हांनी आसीस ॥ नर अली
मम्हद सांहां ॥ स्पा पीतं पे
पूफू ल पूरा ॥ तं पे सा हिफ
सूल तांना ॥ नें हुप ना आर
फ सुषांनो ॥ सेत्र दीपे अेरा
मंहि पीधां मवां म ॥ नें आवा
प सा हुअ पा ल तांना ॥ नें हा
गुजर मंहि पीधां ठांम ॥ नें आ
पी प सागर पत गांम ॥ तेनु
पात्र प्पर पा अेदर ईमामसां
हांना मा ॥ नें पूर सेअंनत
पुरी डाळ पूना प्रांम ॥ तेनुन

[illegible]

[illegible]

[illegible]

हो पाना प० ॥ ग्रु हो पांना ३२

हो पा २ ठासे ... हे प पा प

ना सानी नी छे: अ२ मांनन:

अ सम लो क २ रे कि मांना॥ना

२ २ कि म॥ स त गोर पा २

अ २ मां॥ ... ह २ ई मा म सां कि॥

... ह पा स न प न २ र्न न॥ न २

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

खरीपूं माईमा भर वृत
आपी॥ प खी मृ सा फर नी
राडी॥ ग तणं प सीनं मात
मा कि धी हींका त पाडी॥ जा
यजा मा नेजगा डी॥ प लावी
घरं प नेय सा वा पा डी॥ र
षी सर भहाजी स फाओ त
प भू ल पु री॥ पु रां तं पी पर
सी तं पी॥ पर सी तं पी॥ गार
जर खिली ओपू॥ आं खर पी
कि ही पु आप अ वं तार॥ जी
भू ही पैं मा गार जर नी प
रपा र॥ र षी सर भहा बुज
रर कि प पु री॥ फी ल भला
ह फीघ री॥ ही पा आसा स

[illegible]

ॐ॥ हीवाणी ५२ ॥ ॐ॥

हीवाड़ि घोणाणासपूरेमाषईई

हीवाबालपूतघाणवाघर

पीनेणापाघ्रांकुमाणीछः पार

पांणजि बासपालां करहे

पान णहरहि पा॥ सतगोर

ईपांप सांहां॥ णरमलीप

हपांदसांहां॥ णबाहुरसत

गोरतंपारीहीवा॥ आदणर

जंणघेघोपुर॥ जपपंहणा


सरणंणहार॥ मर पांपां मो॥

पीसणपपामो॥ पाहि सरपां

मोः श्रीपाछणी पां मो॥ श्रीपो

रंतणी पां मो॥ श्रीपारांणीपा।


realpatidar.com
realpatidar.com


realpatidar.com
realpatidar.com

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

पंडा पाकाी॥ जबी आपुरस॥
अमसरपुजा परण त॥ नाप
पुपनागा॥ आरपुज पिघा॥ आ
रूपांफा॥ आरपांफा॥ आरवे
हे॥ आरपुतप॥ ते जी सपुरी
डीनापुरीसाप॥ जीलापु
नीहीघीपांस॥ रूपांपीतंपा
रनापपुापुंफा॥ तंपारिपुरं
पि॥ तंपारिघरंपि॥ अजपने
सतपंथनापारगापाराप्यो॥
गोरनोरनाहिदार आपा॥ आ
जपनाघांनापपुसी॥ अं
परापरीपापासः आपा॥
अजपनगानगातपारी छे॥
अजपनी संतातंपने छे॥

अेजमबेमामुमामनकुरी
सतगोरईमामसांकासनर
अलीमनोमदसांकांसकुल
अेसोकाईससांकामनमद
ररसुससांकां हीवां॥पर॥
हीवाबरकुनानेपांकुंमां
वांईवांनीछे॥ फरमांनजे
मासमसोकररेकेमांनन
ररकीम॥ अेदरईमामसां
का॥ अाईवासनवनारनो
नानार॥ अलीमनोमदसाहि॥
सतगोरपीरकबीरदीनः॥
सतगोरपीरसोदरदीनः॥
सतगोरपीरसाहिबदीनः॥
नसीरदीनः॥
सतगोरपीरसंसदीनः

सतगोरपीर॰सांभसहीत॥
नरअसलोभसाहा॥नर
असलीनरणंनानोभ॥नोअपा
नुरसतगोरतंभाराहीवा॥
गोरवांझां॥नरवांझा॥नू
हरसपुतीवांझा॥वांरभा॥
भासनथ॰भाहिसरवांझा॥
फरभाननारांअमा नुर॥स
तवांझां॥हतवांझा॥वेदवा
झां॥आदआलसतपंथ
नावांझा॥वेदवंसपरवा
रनावांझा॥नवखांडप
रथंभनावांझा॥मोवास
भालपुनावांझा॥असर
फुलपरवतनावेंझां॥

नवकुळनागनावांमा॥मा
रकुळवेदनावांमा॥मात
साकेरनावांमा॥नवसे
नवांकाळनदी [illegible] नावांमा॥मा
रभांकाः मारवांका॥नावांमा॥
मारवेद॥मारकुतमनावां
मा॥अडारभारवंनसपती
नावांमा॥मंदरभास्कुरननी
वांमा॥नवलाखतारानी
वांमा॥अठिदजवंननादेव
लोकनावांमा॥अगनाते
अंननदेवनावांमा॥धर
तीभाकुासनावांमा॥धह
कुारनावांमा॥कुरनापुल
मनावांमा॥नडकांधनकु

ગનાવાંમા॥ ઈંદ્રછેદાના
વાંમા॥ સતદેતનીવાંમા॥
દેઆ ખેતાંનીવામાં॥ સતી
જતીનાવાંમા॥ સતીપુરેહિ
રુનીનાવાંમા॥ અડસઠતી
રથનાવાંમા॥ નવનાથચો
રાંસીસધનીવાંમા॥ સો
સચઅઠાસીરુખાનીવાં
મા॥ એપુલાખ નેએંસી
હજાર॥ ચારપેગાંબરના
વાંમા॥ નવાંકુપુરીડાના
ખાનીવાંમા॥ છપંનપુરી
ડાછીધાંનાવાંમા॥ અનાંત
પુરીડાદેવનરનાવાંમા॥ અ
સપુરીડાપરસાજનાવાંમા॥

સાતે ક્રોડસુ હરીચંદના
વાંઆ॥ નવ ક્રોડસુ જે
સટલનાવાંઆ॥ બાર ક્રો
ડસુ [illegible] પરનાવાં
આં॥ અનંત ક્રોડસુ પીર
હસનસાંહાંનાવાંઆ॥ ક્રો
લર [illegible] ગતગંગાંનીવા
આં॥ [illegible] રનાવાં
આ॥ સાત [illegible] રસંતાનાવાં
આ॥ [illegible]
નીવાંઆ॥ [illegible]
સંનીનીવાંઆ॥ ક્રોલ ક્રો
અંજનીપરવારનીવાઆ॥
અનંત ક્રોડનાપીરહસ
નસાહાંનીવાઆ॥ ક્રોલ

रषीसरजा तजाजानीयां
आ॥ पमाफुसाफरनीयां
आ॥ आदिनादनीयां आ॥
आदिनाद अफुपांरे घर
पधायापी॥ सतगोरपी घोला
सतारा॥ आद सतपंथना
पापंनाफुरा॥ वेदवंसतो
आवाहरा॥ पापंनाफुरा
दियाडा घरंपा॥ रषीसरजी
पुनादितारोफुरंपा॥ पेला
सरणावेदनेवांया॥ पछे
सरजाआरेयांया॥ जेणे
सतपंथपसा॥ तेने आवा
गांपनाफेराटला॥ फर
पांनतपाद्र॥ सतदतयां

2010 Before -Satpanth Manuscript 11 -Pooja Vidhi & Others (161)

आरंभो:

अपत१९ नो छु०तंरान साल न

आयो पड आवी छे त अपि मु[illegible]

हुप क रत नाम छे ते या पड पा तेना

नी छे कुं नो द र द्दा वाना की व

पातेन गरना छे पा त मु न तीजा

र ० द छे द्दा द्दा रा न क ल न न दा

र न रा न र जा नी छे हां मु नी है क

रा त ता नाजे रा आ त गान पाता

कना नेत र न रेवो रा नर० नाइ न

फ ने र न रा दरे वंव न जी को । १

१

૨

હવે બાવા ગુરૂ તેધાનના ઘર
ણીની પછાંપુજાની છે: પારસ્ત
નણ્ગ·બીસમલાં·કરેહિમાન·ન
રરહીમ॥ સતગોરઈમામસાહા॥
નરજ્ઞ મલીમહમંદસાંહાં॥ નબી
નુરસતગોરતે માંરી હાવાજ્ઞ માં
હનરનંનદ્યં ઘોપ્રાંર॥ ગ્ગવમહન
સરનંનહાંર॥ બારમાંયાંયાં॥ બા
સનવયાંયાં॥ માહિસરયાંયાં॥ શ્રી
મછની બાંયાં॥ શ્રી કુરંમની બાંયાં॥
શ્રીબારાંની બાંયાં॥ શ્રી નરસાંહાની
બાંયાં॥ શ્રી બાંમનની બાંયાં: શ્રીપ
રસરાંમની બાંયાં॥ શ્રીરાંમની બા
યાં॥ શ્રી ક્રુરસંનની બાંયાં॥ શ્રી બુ
ધની બાંયાં॥ શ્રી નકલંક ક્રાનારાઇ

કાનીપાંઆં॥ કજ ગીલાકાં સાકાં
ખુરતના ઓ લી॥ નાપના જુરસાત
ગાર॥ નાર અસલાં પસાંઠાં॥ પાર
નાપર દે॥ સાત ગાર સલાં ઓ દાન॥
પાર સાંદર દાના॥ પાર પુપાર દાના॥
પારઈપાં પસાં કાં॥ નર અલી પક
પદસાં કાં॥ સી ચસીચ કાંસીની
પુલ પા ઓ પનાં પરપાર॥ નાપુ
દીપે॥ નર તપાંક॥ પુપારપાંપે
ચપાં॥ કુપાં દસ પાં એપતાર॥ ન
રનંનન પુ કો પુનારાં ઓકા॥ પાં
ચપાર પાંનર કરી॥ અપર પેદના
પાંઠી નાંકાની॥ જીવનાપાં પુકાપા
ઘીઓ તા॥ જીવ નાપાં આ જુરાંકી
પાંએ॥ તજીવ અપરાં પરનાં એ॥
તજીવ પેરાં પી છાટી॥ અંપરાં પર

[illegible]

ભારી છે ॥ જ્ઞાન નો સતાતભણે
છે ॥ જ્ઞાન વણે પાવ્ય પાવે નવ્ય રો
। સતગોર ઈમામ સાં હાં ॥ નરઅ
લી મહમદ સાં હાં ॥ હ્વલા ઝીલા
હાં ઈલ લાં હાં : મહમદ રસુલલ
હ : દાવા ના પર ॥ ❀ ॥ દાવ
ર ઈના ને પા પ્રમા ઘવાં તી છે :
પાર માન જ ॥ બીસ મલ : હરરે હ
માન નરરહી મ ॥ ઝીદર ઈમામ સ
હાં ॥ સાંદેવી સનપનર ર્ણ ॥ નરઅ
લી મહમદ સાં હાં ॥ સતગોર પીર પ
બીર દીન ॥ સતગોર પીર સોદર
દીન ॥ સતગોર પીર સાહબદીન ॥
સતગોર પીર નસીરદીન ॥ સ
તગોર પીર સંમસદીન ॥ નરઅ
સલાંમ સાં હાં ॥ નરઅલી [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

રખાંસુરનની વાંઆં॥ નવલાખ
તારાનાવાંઆં॥ અઠ્ઠઈ ઇન્દ્રના
દેવલોકનાવાંઆં॥ અગનીતે
જઅનદેવની વાંઆં॥ ધરતીઅ
કાસની વાંઆં॥ ધધુકારની વા
આં॥ કુરમાકુલધનની વાંઆં॥ નં
કલંધનજુગની વાંઆં॥ ઈહ છ દાંન
વાંઆં॥ સતદતની વાંઆ: દેઅરબ
પાંની વાંઆં॥ સતી જતીની વાંઆં॥
સંતોષ રેહણીની વાંઆં॥ અડસઠ
તીરથની વાંઆં॥ નવનાથ ચોરા
સી સધની વાંઆં॥ સિસઅઅઠ
સીરૂખીની વાંઆં॥ એકલાખ
અંસી હજાર॥ પીર પેગંબરની વા
આં॥ નવાણુ કરોડ ભાણીની વાંઆં
છપન કરોડ જાદવાંની વાંઆં ॥

૪

ચાલીસ ક્રોડ ઉનરની વાંચા ॥
પાંચ ક્રોડ સુ પરલાદની વાંચા ॥
સાત ક્રોડ સુ હરીચંદની વાંચા ॥
નવ ક્રોડ સુ જુજેસટરની વાંચા ॥
બાર ક્રોડ સુ પંજાબા પુંવરની
વાંચા ॥ અનંત ક્રોડ સુ પીર હસ
નસાંહાની વાંચા ॥ ફ્રોલર ખેસૈર
ગતગંગાની વાંચા ॥ જમાત જુસાપ
રની વાંચા ॥ સાત પરસંતાની વાં
ચા ॥ ઓસઠ લાંખ દેવી દેવની વાંચા ॥
સત સમસત કાસીની વાંચા ॥ ફ્રો
લપું ચ્મ જનાં પરવારની વાંચા ॥
અનંત ક્રોડાના પીર હસનસાં
હાની વાંચા ॥ ફ્રોલર ખેસં રગતગં
ગાની વાંચા ॥ જમાત જુસાપરની
વાંચા ॥ આદ દેવ નાદની વાંચા :॥

आदद्रीनांद अकरांरीघरपधा
पा॥ सतगोरीकराघोपासतार॥
आंदसतपंथनाथांपनाप्रग्री॥
वेदवंसेतां आंवांहरा॥ थांपनां
करारीएआंडांघरवा॥ खेसरण
थनांद्रीतारीकरवा॥ पेलांसरणे
वेदनेवांहा॥ पछेसरणआंरीए
हा॥ णेजलसतपंथेपलां॥ हेने
आंपाजांवननाखेरांटलां॥ प
रपांनेतेपावू॥ सतंदतवाआते
पो॥ फरी आंदवीनती आंपो॥
सतगोरदेपांपसांह॥ नरअ
लीपहपदसांह॥ हकलाजेलो
हाः इलललाहो॥ पहपदररसुल
लाहः दोवा॥ ५३॥ दोवा
करासद्रीपरसा आमाद्रीतारवा

૫

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

૧

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

મહમદરરસૂલલાહિઃ દીવા:
॥૫૬॥ ❀ દીવાપૂરમનોલા
ઈસ્ટલઘુ તારવાનો છેઃ મારા
નબી. અલીસપાલાર. કરરીમા
ન. નરરહીમઃ સતગોરઈમામ
સાંઈઃ નર=અલીમહમંદસાંઈ
નબીનૂરસતગોરતંમાંરીદીવ
માટપાપઃ નૂરપાપઃ નરનંનન
રા=અલીપાપઃ પાંચતંનપાપઃ
ચારદીમાસૂમપાપઃ દીવાનદ
ઈમામપાપઃ તંમારૂનામપાપઃ
તંમારૂઠાંમપાપઃ તંમારાનામ
નૂરનીપરતાપીઃ પરી=અલીઅદી
પાપઃ નંબી=અસમાંનપાપઃ
પવનપાંણીપાપઃ ચંદ્રાસૂરનં

पांचमांत्रानुछे: जगाजाग गंता:गो
रजवजुता:छेलीरीगी:पतरपाडी
जंगाएलालजंगोटा:पाधतंगीरंन
नामाला:काअसुहरजा:रंजगोडीआ:
छेगिचीपटा:जालरकोठ गकार:लाई
हेपारवतीनार:तेलीजेतारा:नेरवसु
घरमेमाधीं:जरछीईरसी:डेराहुमरा:
रातामगीजा:पीलामंगीजा:लीलामं
गीजा:पासेंगा:देवेईडेरजा:करीजे
गुगरा:श्रीजेमधंगा:जनेजतंगाजा
वांनरजवाला:जालडाजलका:घ्यान
कीधुली:जकलडाजडजंघ:जागे
तोछेगजंहा:नरतोजेडीवीडीजोगा
छारपडीतोघोडान:जंमांनेमनपन:
पासमांत्रसुपुरणहई:गाइहिजेठमारेगा
रपनाथवा:जलपरजपरसहीधीसे
जाग्या:

2010 Before -Satpanth Manuscript 11 -Pooja Vidhi & Others (161)

नवनाथ चोराशी सिध:सिधाकुसला
प्र:गोराक्षुपरनाम:सेजागाद्गुरेहर:॥
॥गोरखजी नरजेनरजे:धंधुकारा सेवसे
गतीने: फेलूयाचेसारा:जोतरा जिंदगे
लेजाणि तारा:सेवसेगती हेली
गणजी गंण:लंगकाटके ज्ञासिण
हिज्ञा:नकासीरके नंगज्ञनाज्ञा:जं
गेरुपरकासे कीज्ञा:लेगेरु सेवसेगती
नेहीज्ञा:हंसेचाले हैसावरा:कोरणी
नेहने जे:गेरुपाणी जंचरा:हंसचले
हैसावरा:कारपीताजरने जेलगवा
जपसंपुरण कुज्ञा:गादीजेठ गोरु
हतान हिंदुज्ञा:जंपनाजाप:कुटे
नाथाय:जालंधर नंदीजेनजायोजा:
॥गोरखजी आसरणे:धरतीरीफले

अेसकीपासगायतरीयरे:पुछमो
अरे:पवनमुखरेसुर्:भगानमुखअन्दे
अेसवानसमीकोबाली:नवटाक
नजुतीसबाटाकापाटी:सडेआवा
गोहूलपाका:हनीआपरअलागेया
व:नजुत नंत्र:सेंपुरहएाउीआ:गही
जेठगोहूतातरीकीआ:अंपंता
अप:काटतापाप:आलजनरअंन
आसोजाप:[illegible] गोहूं धरतीआहें
न:तमामुल:गोहूंजेठाकमलके
फुल:कोनमुखछरी:कोनमुखधा
र:कोनगोहूंने:मुहाकोरे:कोनगोहू
नेहीआआपहेरे:कोनगोहूं
आगानमुखछरी:पनमुखधार
गेआनगोहूंनेमुहाकोरे:सनगो
हूंनेहीआआपहेरे:नरअंनटना
न:

[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

૧ મેખનો ગ્રહ: મંગળ ચાર: અગાળ મેખ

૨ વ્રખનો ગ્રહ શુક્ર ચાર: બાવાઉ વ્રખ

૩ મીથુનનો ગ્રહ બુધ: ધાગાગામીથુન

૪ કરકનો ગ્રહ સોમ ચાર: ડાડાકરક

૫ સીંહનો ગ્રહ રવી ચાર: માટાસીંહ

૬ કન્યાનો ગ્રહ બુધ ચાર પાઠાણ કન્યા

૭ તુલનો ગ્રહ શુક્ર ચાર: રાતા તુલ

૮ વરસ્ચીકનો ગ્રહ મંગળ ચાર: નારત વ્રસ્ચીક

૯ ધનનો ગ્રહ બ્રહસ્પત ચાર: ભોગાડા ધન

૧૦ મકરનો ગ્રહ સની ચાર: ખાના મકર

૧૧ કુંભનો ગ્રહ સની ચાર: ગોરી કુંભ

૧૨ મીનનો ગ્રહ બ્રહસ્પત ચાર: દાના વાટયા મીન

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

सपतषडमह॥ साषुजम॥ जि
स्वामी जिजाद॥ आवीगत॥
तुमेसरणते॥ सपतपातालगा॥
मोरनापुवात॥ मोछननाआ
रननगा॥ मोरनापुवात॥ धो
रलोननाआरनलागा॥ मोर
नापुवात॥ वैरानना आरनप
नाआरनलागा॥ मोरनापुवत॥
जारसाहीनानना आरननगा॥
मोरनापुवात॥ वामननलाना
आरनलागा॥ मोरनापुवात॥
फसरामनना आरननागा॥ मो
रनापुवात॥ रामनना आर
ननागा॥ मोरनापुवात॥ कर
सननना आरननागा॥ मोरना
पुवत॥

ऑद्दणना आरणनागः मोर
नाप्रयातः नाक्षमप्रानारा
ननः कुरतना आलीः आ
ननाक्षमप्रा आपरां आपरेः
पासनापाहालॉपरमः श्री
सामधरमः नना आरनन
गाः कुपालासः कुरसतगॉ
रः नरगॉपादः श्रीसलाम
सामः नरगॉपंदः कुरना
प्रयातः धरमारगाः सॉपाग्रगाः
साचमपुरः गहापहमः सर
गाधरमः सरगाधरमपा
आॅतमगाः ॐममनसनन
सॅनः ॐममननॅलापहनः
ॐमाममामहपापुरः

ईमामनापरसाइष्:ईमाम
आसमाईलासामाना:ईमा
मछरमामम६:मवलालेलाजे
लेलामामामम्धररस्जलाप्ने
॥मार॥ ॥मारनाभ्यतछ
घरमलेप्पुछे:सापारनापा
रमामारनाभ्र्तनाईता:ईम
मननलापघन:सलेलाज्ञाते
पेसलमनामानापाछपप
पाजे:द्वांपरमडतामारना
प्पातनाईता:मातापनमा
नाहद्वाफरपाछपमपजे
तमा:प्पापारनेपाप्पतमारना
प्पपानाईता:नापामामम
हनामेलसमाछठाछधरमपे

[illegible]

तेपावामानेष्ठनेसावालपडा
पेता:तेनडूतष्ठलनष्ठरतासा
ऋपेलडपाऋपे:तेनेसाम लहेहार
ऋापे:तेपालसतनासालष्ठरे:
॥ मारनामडवातनालसातते
लाछ:वालतछामदि:नानेवा
ऋंता:ऋंष्ठहाडामाऋंष्ठवारने
पे:ऋं मेष्ठरतानोछनासाष्ठऋं
ता:हडाऋाठमाऋंष्ठवारनोपे:
ऋंता:ऋंष्ठमछनामानोपे:ऋंम
फरतानोछनासष्ठता:वाररह
डामाऋंष्ठवारनोपे:ऋंमष्ठर
तानोछनासष्ठाता:ऋाला
ढ्ढगरमाऋंष्ठवारनोपे:तेन
लेसतनासालष्ठरे:नेष्ठम
[illegible] हा हाता:

मोरनाथपा तपामानक्रे॰
नेकमकरेतेहश्रीमामहसज
पाश्रे॰ तेपामोरनाथपत
नेपान्हसरपेधरमछे:
कपतेपारसांहरहान:
कपारहान: माग करा:
नेनापानेने: हकजश्रजा
श्रहेजेजोमेमहमदररस
जेजोहे: मरनाथपातना
पासाश्रे तसप्ररपाछे: हा
नेशमानेनहरलमगमस
ररसजा पापर नेपामतेने
श्रीमारसजामछे: नेपम
नेतपासानेपानेनेकोशप्र
नेत्र श्रीश श्रहक्रोहातेमाक्र
करणं

[illegible]

मी सत गोर पनर जा। बा। आ
री ठीः सत गुर तं [illegible] री जां
म [illegible] रना। री: र [illegible] रेर [illegible]
रो। जा लो। [illegible] [illegible] तीः ॥१॥
हं [illegible] पर तं [illegible] [illegible] म [illegible]
[illegible]: रा। [illegible] प ड [illegible] रा
[illegible] [illegible] पंदा। २॥ त [illegible] [illegible]
[illegible] [illegible] [illegible] [illegible] [illegible] र रा। [illegible]: [illegible]
र गात मा। [illegible] [illegible] [illegible] [illegible]
[illegible]॥: ॥ ३॥ ती तम गुरु [illegible]
पंदा: र [illegible] रा र [illegible] [illegible] [illegible] [illegible]
[illegible] [illegible] मवे दा [illegible] र [illegible] रा
र जाइ: [illegible] [illegible] [illegible] [illegible] [illegible]
रा [illegible] पाइ: ॥४॥ [illegible] [illegible] मा रा
[illegible] [illegible] म ता जोइ: [illegible] [illegible]
[illegible] [illegible] [illegible] [illegible] [illegible] जोइ: ॥५॥

हर न रतना भाखा पी गईनावाता
नां करसो: तो ज्ञा र जाइ गा फ्र दीप
र ना। जर उगे ॥७॥ ज रसा
पीर तां जा। रे भासो: ज्ञाव सो
नी हरा प ऊप सत सो: ॥८॥
त लां प पीड ठा । सक भो
: जा ग तज तप सत गुरनी भा
सो ॥९॥ तं जे नां ना भोइ। नां ज्ञा
हपी रजो: भा आत दाा भाखा
ज्ञाव गुरुना सो वो: ॥१०॥ हपी
भोइ। तपर सो हुरी जोया:
पो लावो नार पजों ना परगो
पो: ॥११॥ वि जाप पन पी नो
नरानह: त ज्ञाती ठ भा टेरा
साह ॥१२॥ जी वी पजनेप
ला भा पी रा: हति भाजो

जम लाफी नरेली राः॥१३॥
मात गाुवान लाला मो छ
मंदः द्राइ द्र मांना क्रे रे मांथा
द॥ः॥१४॥ जोपु साना लासा
जु ण आभि मजो दुडां:त णोकुंपु
णसाइप आजा जु डां:॥१५॥
मोल साली दराण द्रर ग्वीणुपुा॥
कुरतल वीवे दपमो णपर मंडा
॥१६॥ दुडक्र पड सरपेला
पा: द्रांडि: आणी उस पीआणा
सांणालीवे दाडि:॥१७॥जा
रप्रु: दकुरम द्रांपारे कापा:
उपकाली नाप णी सा
णीलाली:॥१८॥ सां पंतठ
पणेतत मील वी: जुपा सोरु
[illegible] णाद्र रमांधा
॥१९॥

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] ॥१२॥ [illegible]

[illegible]

[illegible]

॥१ [illegible]

[illegible]

[illegible] ॥१३॥

[illegible]

[illegible]

[illegible] ॥१४॥ [illegible]

[illegible]

[illegible]

[illegible] ॥१५॥

[illegible]

[illegible]

॥१६॥

आवत ओजुडाथा नीता० कुंडे० आं डी रे रा०

रेरताने रेरतां पारन ही आपे० सां डा मुनी पर

नी मतीर० आवत ओजु डाथा नीतां० पात पाआ

रां पारा के मारे० त मोनो [illegible] री लितर रे० [illegible]

हीप मांम उरेजिड० आडा मुंनी पारे पा सारीर०

आवत ओजु डाठ नाता० लथ्य पांरारीतामो कुडो

ध मोटी० सां डां मुनापर पा मारीर० हरता नोरे

रता पर नाप ह० ह ली आपम्याेंह हाडारे० आ

वत ओजु डाशे नीतार० मंगारे भाग मां जु पो

पीमारी० ल म महादि गा मो भारी आम रीत पे

[illegible] का मांत मे आड वाव मालो० आमद [illegible]

पाताामो रारीर० आवत ओजु जडाठो नीताउ

मं कुहीप मांत पतर आपे० लरां मडा मां प्रात मंड

तारे० पे ह पोराडा मां कुदोमना मारी० आ डता के

र ड नो नानाम० हां डाीर० जवत पां जडाथा

तो र

[illegible]

[illegible]

२५ग ५

महन नाहक्रागतनापरक्षु

३ध मानीधर ६२८


realpatidar.com
realpatidar.com